

ગાંધીનગર સમાચાર

બિન અનામત વર્ગ માટે ૧૦ ટકા અનામતનું જાહેરનામું પ્રસિદ્ધ



(તસવીર : કશ્યપ નિમાવત)

‘રન ફોર ગુજરાત’ - ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે તા. ૧લીમે ના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘રન ફોર ગુજરાત’ કાર્યક્રમ અન્વયે ટાઉન હોલ સેક્ટર-૧ ૭ ખાતેથી સવારના ૭.૦૦ કલાકે લીલીઝંડી ફરકાવીને જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંજીવકુમારે દોડને પ્રસ્થાન કરાવી હતી. ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કૌશિક ભીમજીયાણી, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી અને ગુડાના ચેરમેન શ્રી આશિષભાઈ દવે સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ આ દોડમાં જોડાયા હતા.

ગાંધીનગર જિલ્લાનો રૂ. ૨૭૯૮.૯૭ કરોડનો ક્રેડિટ પ્લાન

સોલાર ઊર્જા, સોશયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એક્સપોર્ટ ક્રેડિટના નવા સેક્ટરો ધિરાણ પ્લાનમાં સમાવાયા ગ્રામીણ અર્થવ્યવસ્થા સુદંટ બનાવવાની સાથે કૃષિ વિકાસ પર ધિરાણ પ્લાનમાં ભાર મુકાયો

ગાંધીનગર, તા. ૧ ગાંધીનગર જિલ્લાનો વર્ષ ૨૦૧૬-૧૭નો ક્રેડિટ પ્લાન રૂ. ૨૭૯૮.૯૭ કરોડનો રજૂ કરાયો છે. જે ગત વર્ષ કરતાં ૧૫.૫૧ ટકા જેટલો વધારો દર્શાવે છે. જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકર દ્વારા લીડબેંકે વિવિધ શાખાઓ સાથે પરામર્શ કર્યા બાદ તૈયાર કરાયેલ આ ધિરાણ પ્લાન જાહેર કર્યો છે. નાબાર્ડ દ્વારા રજૂ કરાયેલ પ્રોજેક્ટેડ લોન પ્લાન પર ચર્ચા વિચારણા બાદ આ ધિરાણ યોજના તૈયાર કરવામાં આવી હતી. આ વર્ષના ધિરાણ પ્લાનમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રમાં ૨૫૨૯.૭૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે તેમજ ૧,૩૭,૭૮૭ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત આવરી લેવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જિલ્લામાં કૃષિક્ષેત્ર અને પાક. ધિરાણ પણ સૌથી મોટી ફાળવણી કરી કૃષિ વિકાસને વધુ પ્રોત્સાહિત કરવા માટેની દિશામાં મહત્વના પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસ માટે પણ ધિરાણ નીતિમાં જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લામાં હાઉસિંગ નિર્માણની પ્રવૃત્તિને ધ્યાને રાખી ધિરાણ પ્લાનની કુલ જોગવાઈની ૧૯.૫૩ ટકા

● અનુસંધાન પાન-૭ પર

Advertisement for Valam Bhadha Desalu featuring a portrait of a man and text about a health product.

ખ-માર્ગ પર સરખેજ માટે વિકાસ રૂટની ૬ ટ્રીપોનો પ્રારંભ

સે-૪, ૫ અને સે-૧૩, ૧૪ તેમજ સરગાસણ વિસ્તારના રહીશોને બસ સેવા સરળતાથી ઉપલબ્ધ થશે

ગરમીમાં નહીવત ઘટાડો : રજાના દિવસે શહેરમાં ગરમીના લીધે સશાટો

ગાંધીનગર તા. ૧ શહેરમાં છેલ્લા ચાર દિવસથી ગરમી પ્રકોપ યથાવત રહેતા નગરજનો અસહ્ય ગરમીમાં બેબાકળા થઈ ગયા છે. ગરમીનો પારો છેલ્લા ત્રણ દિવસથી ૪૦ ડી ગ્રીને પાર રહેતા શહેરીજનોએ બાનમાં લીધા છે. આજે પણ મહત્તમ તાપમાન ૪૨ ડી ગ્રી રહ્યું હતું. જોકે ગઈકાલની સાંપેક્ષમાં ગરમીનું પ્રમાણ ૦.૫ ડી ગ્રી ઘટ્યું હતું. સતત ગરમીના લીધે નગરના જનજીવન પર વિપરિત અસર જોવા મળી રહી છે. જ્યારે આજે રજાના દિવસે ગરમીના આકરા મિજાજથી બચવા નગરજનો ઘરમાં પુરાઈ રહેતા શહેરના માર્ગ પર દિવસ દરમિયાન સુનકાર જોવા મળ્યો હતો. શહેરમાં છેલ્લા ચાર દિવસથી ગરમીની ઝુલનુએ ઉગ્રતા ધારણ કરતા

મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી રહ્યું છેલ્લા ચાર દિવસથી નગરજનો આકરી ગરમીની ગિરફતમાં

નગરજનોને બેબાકળા કરી દિધા છે. ગરમી ૪૦ ડી ગ્રી થઈ ૪૩ ડી ગ્રી પહોંચી જતા છેલ્લા ત્રણ દિવસથી નગરજનો અંગ દગડાડતી ગરમીમાં શેકાતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. જ્યારે ગરમીના લીધે સન સ્ટ્રોક તેમજ ડીહાઈડ્રેશનના કિસ્સા વધી રહ્યા છે. બપોરના સમયે ગરમીથી બચવા માટે સેક્ટરોમાં કોઈ બહાર નિકળતું નથી. હરિયાળીમાં વિસામો શોધી ગરમી પ્રકોપથી બચવાનો પ્રયાસ કરે છે. આકાશમાંથી અનજવાળ વરસતા દિવસે ગરમીથી ગુંગળાતા નગરજનો રાત્રિના સમયે બહાર ખુલ્લામાં ફરવા નિકળી પડે છે. જોકે આજે ગરમીનો પારો ૦.૫ ડી ગ્રી નીચો આવ્યો હતો. આમ છતાં બપોરનો તાપ અસહ્ય રહ્યો હતો. ગરમીમાં નહીવત ઘટાડો થયો હતો.



(તસવીર : કશ્યપ નિમાવત)

પોલીસની ત્રીજી ઓંખ - ગાંધીનગર શહેરમાં સલામતી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુસર શહેરના તમામ માર્ગોના પ્રવેશદ્વારો અને જંકશનોને સી.સી. કેમેરા પેનલથી આવરી લેવાયા છે... હવે શહેરના તમામ માર્ગો પરથી થતા વાહન ચાલકો પર પોલીસ તંત્રની ત્રીજી ઓંખ સતત વોંચ કરશે...

ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ) થી બચો

- આરોગ્યલક્ષી સૂચનો
હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ટંકાઈ તે રીતે સફેદ સુતરાઈ ખુલ્લા કપડાં પહેરવા, ટોપી, ચશ્માં, છગીનો ઉપયોગ કરવો.
નાના બાળકો, સગાભાં માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને ઊંચા વયના વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી સીધા સૂર્ય પ્રકાશથી બચવો
ભીનાં કપડાંથી માથું ટાંકી રાખવું અવાર-નવાર ભીનાં કપડાંથી શરીર લૂછવું વારંવાર ઠંડું પાણી પીવું
લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા
બાળકો માટે કેસૂડાંનાં ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો
ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસતી ટટ્ટી પાછી છાંટી બાંધી રાખવી
દિવસ દરમિયાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું
બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઈટમ ખાવી નહીં
ઉપવાસ કરવાનું ટાળવું, સવારનું ભોજન ૧૨ વાગ્યા સુધીમાં લઈ લેવું
ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું

- લૂ લાગવા (હીટ વેવ)ના લક્ષણો
માથું દુ:ખવું, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો
શરીરનું તાપમાન વધી જવું
ખૂબ તરસ લાગવી
શરીરમાંથી પાણી ઓછું થી જવું
ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા
બેભાન થઈ જવું
સુઘ-લુઘ ગુમાવી દેવી (મુંઝવણ)
અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી

વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા), અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય, રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબૂચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.

લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

ગાંધીનગર તા. ૧ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ખ માર્ગ પર એસ ટી બસ સેવાનો એક વધારાનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. જેના લીધે સે-૪, ૫ અને સે-૧૩, ૧૪ ના રહીશો સહીત સરગાસણ વિસ્તારના નાગરિકોને સરખેજ તેમજ અમદાવાદ રૂટની બસ સેવા ઘર આંગણે થી મળી રહેશે. ગાંધીનગર એસ ટી ડેપોની સેવાને અસરકારક બનાવવા માટે સમયાંતરે જરૂરી રૂટ અપગ્રેડ કરવા ઉપરાંત વધારાના રૂટ પણ શરૂ કરવામાં આવે છે. લાંબા સમયથી ખ માર્ગ પર સરખેજ માટે વધારાનો રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની હતી. જેના લીધે એસ ટી ડેપો દ્વારા રાજ્યના સ્થાપના દિવસે શહેરના ખ માર્ગ પરથી સરખેજ રૂટની બસ સેવા શરૂ કરવામાં આવી છે. આજે સવારે ૮ : ૩૦ કલાકે સરખેજ જતી બસની સેવા શરૂ કરવામાં આવી હતી. ડેપો મેનેજરના જણાવ્યા મુજબ આ રૂટમાં વિકાસ રૂટની સફેદ બસ દોડાવામાં આવશે. જ્યારે ખ માર્ગ પરથી આ રૂટમાં ૬ ટ્રીપો દોડાવાશે. ખ માર્ગની સરખેજ રૂટની બસ સેવા શરૂ થતા સે-૪, ૫ અને સે-૧૩, ૧૪ ના રહીશો તેમજ સરગાસણ વિસ્તારના નાગરિકોને પણ ફાયદો થશે.

ગાંધીનગર તા. ૧ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ખ માર્ગ પર એસ ટી બસ સેવાનો એક વધારાનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. જેના લીધે સે-૪, ૫ અને સે-૧૩, ૧૪ ના રહીશો સહીત સરગાસણ વિસ્તારના નાગરિકોને સરખેજ તેમજ અમદાવાદ રૂટની બસ સેવા ઘર આંગણે થી મળી રહેશે. ગાંધીનગર એસ ટી ડેપોની સેવાને અસરકારક બનાવવા માટે સમયાંતરે જરૂરી રૂટ અપગ્રેડ કરવા ઉપરાંત વધારાના રૂટ પણ શરૂ કરવામાં આવે છે. લાંબા સમયથી ખ માર્ગ પર સરખેજ માટે વધારાનો રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની હતી. જેના લીધે એસ ટી ડેપો દ્વારા રાજ્યના સ્થાપના દિવસે શહેરના ખ માર્ગ પરથી સરખેજ રૂટની બસ સેવા શરૂ કરવામાં આવી છે. આજે સવારે ૮ : ૩૦ કલાકે સરખેજ જતી બસની સેવા શરૂ કરવામાં આવી હતી. ડેપો મેનેજરના જણાવ્યા મુજબ આ રૂટમાં વિકાસ રૂટની સફેદ બસ દોડાવામાં આવશે. જ્યારે ખ માર્ગ પરથી આ રૂટમાં ૬ ટ્રીપો દોડાવાશે. ખ માર્ગની સરખેજ રૂટની બસ સેવા શરૂ થતા સે-૪, ૫ અને સે-૧૩, ૧૪ ના રહીશો તેમજ સરગાસણ વિસ્તારના નાગરિકોને પણ ફાયદો થશે.

Advertisement for Sanghi Cement, Kisan Ashirvad, Benelave, Dr. Fixit, TATA Steel, and Vinayak 500 TMT Bars.

બિન અનામત વર્ગ માટે ૧૦ ટકા અનામતનું જાહેરનામું પ્રસિદ્ધ

ગાંધીનગર, તા. ૧ રાજ્ય સરકાર દ્વારા આજે બિન અનામત વર્ગ માટે આર્થિક અનામત અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા આજથી ૧૦ ટકા આર્થિક અનામતનો અમલ શરૂ થવા પામ્યો છે. ભાજપ સરકાર દ્વારા બે દિવસ અગાઉ બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે ૧૦ ટકા આર્થિક અનામતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે શુક્રવારે સાંજે મળેલી

કેબીનેટ બેઠકમાં વટલુકમ મંજૂર કરીને રાજ્યપાલશ્રીની મંજૂરી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. ૧૦ ટકા આર્થિક અનામત અંગેનું આજે જાહેર કરવામાં આવેલ

Advertisement for Jaganesh Steel Store, featuring contact information and product details.

Advertisement for MNSP (Kestrig, Labhtrig, Klaparig) and other services, including contact numbers and address.